

Y  
1982

ઓદ્ધાર

સુધર્માસ્વામી ગ્યાનબંદર  
અમદાવાદ, ગુજરાત, ભારત  
સંખ્યા : ૦૭૨૪-૨૫૩૫૦૦૩  
દિન : ૧૯૮૨

૩૦૦૪૭૮૫

૨૬-૩૫

ગ્યાનબંદર



ગુજરાત પરિચય અંથમાળા : ૮

# જૂની ૧૯૭૬

લેખક :

ધનથન ઓઝા



---

નવચૈતન પ્રકાશન ગૃહ : અમદાવાદ-૭.

પ્રથમ આવૃત્તિ : સેપ્ટેમ્બર, ૧૯૯૪

ચિત્રકાર : રતુભાઈ મિસ્લો

(c) ધનવન્ત ઓળા

કિંમત : રૂ-૦૦

[એક ડિપ્યો.]

પ્રકાશક :

આધુભાઈ પટેલ  
૩, ૫૮૮ સોસાયટી,  
સરખેજ રોડ, અમદાવાદ : ૭

મુદ્રક :

મહેન્દ્રકુમાર ગોકળાસ પટેલ,  
શ્રી અડાયતા મુદ્રણુ કલા મંદિર,  
ભીકારી રોડ, અમદાવાદ.

## જૂનાગઢ

“જૂનાગઢની ધરતી પર સમયને હિસાખ  
 કોઈ એ આદેખ્યો નથી. અઠી હજાર વરસો પૂર્વેનો  
 ઉપરકોટ : એ હજાર વર્ષો પૂર્વેનો અરોકનો  
 શિલાદેખ : ૬૦૦ વરસો પૂર્વેનું સોમનાથનું  
 પતન : પાંચસો વરસો પૂર્વેની જૂનાગઢની ધીંગી.  
 કિલ્ડેખધી : હજારો વરસો પૂર્વેની લગવાન  
 કૃષ્ણચંદ્રના દેહાતસર્ગની ધરતી : અને આ બધાંથી  
 પણ વધુ કાળજૂનો ગરવો ગિરનાર; જૂનાગઢ એટલે  
 સૌરાષ્ટ્રનો સારંગ અને જીવતો ઈતિહાસ. એનું  
 સહાય અળકતું કલેવર, એનું સહાય ધખકતું કાળજું,  
 એની સહાય એલાતી વાચા, એનું સહાય તપતું  
 રહેલું ગૌરવ, કાળચકના વારાફેરા વચ્ચે સહાય  
 સચવાઈ રહેલું એનું અણુનમ અરમાન અને અનેક  
 જંઝાવાતો વચ્ચે પણ ઓડતી રહેતી એની જરૂર-  
 માન ધજા.

વાદળ સાથે વાત કરતા જૂનાગઢ અને ગિરનારને માથે ઝુકી રહેલાં લૈરવન્ઝપનાં ડારતાં શીખરનું પડછંદ જાંચાણું અને ઉપરકોટના અદ્ભુત નવધણું ફૂવાનું આંખમાં તમ્મર ચઢાવતું ગહુન જીંડાણું-આ આકાશ અને આ પાતાળ વર્ચ્યેના જૂનાગઢના પ્રગદલ્સ ભૂતકાળ ને તેનાં અગોચર લાગ્ય વર્ચ્યેના જૂનાગઢનો આધુનિક ઇતિહાસ અને તેનાં આજનાં કલેવરને માથે પણ થોડોક દસ્તિપાત કરે.

કુદરતે જૂનાગઢને એક અનોખી જ તાસીર અર્પેણું કરી છે. કાઠિયાવાડનો પ્રવાસી જૂનાગઢની સરહદને અહે છે ને એક કામણુગારી ધરતી તેને અરકતી જણાય છે. લીલીછમ સુષ્ટિ : આંખાની મનો-હર કંતારો, રૂપાળાં વૃક્ષોનાં સોહામણું ઝુંડો, ગિરનારે ધારેલી હરિયાળી શાલ, રૈનકદાર દુમારતો, કોઈક સાઢો પણ સુગંધી, કોઈક લંબ્ય વૃક્ષોથી લરા-વઢાર બનેલો અને મહમાતો બનીને પોતાની વિપુલ સંપત્તિને ચારેકાર ઉડાવવા મથતો, કોઈક આછેરો અને છતાંય રંગીલો, કોઈક સાહસની નારીના રેશમી પાનેતરના રમ્ય લાગતા પાલવની અદ્ભુતી પથરાયેલો, કોઈક પાંખી અને છૂટીછવાઈ વનરાજુથી ભરકી રહેલો અને કોઈક પોતાની ઘેરી ધરાથી તરખતર બનેલો-આવા જૂનાગઢના અનેકવિધ બગીચાઓ

અને ગઈ કાલની ઘેધૂર નવાખીના ઘેનમાં હંજુય ડેલતા જૂનાગઢના આયના મહેલોઃ જૂનાગઢના દેહલાલિત્યને એપ આપી રહેલો તેનો આ ચિત્તાકર્ષ્ણ શાણુગાર સોરઠના કયા દેખતા પ્રવાસીએ દીઠો નથી ?

અને એ ત્રણ હળર વરસોની તેજછાયા વર્ચ્યે પણ જીવતો અને જગતો રહેલો જૂનાગઢનો ઉપરકોટ !

‘જેણે જેયો નથી એ જીવતે મૂવો’ એવા એ ઉપરકોટને! નવધણુ કુવો, એની ધરતીના પેટાળમાં ઔદ્ધવકાળે કોતરેલી મનાતી શીતળ ગુફાએા, એક વેળાની ભાંડી ખાઈથી રક્ષાયેલી તેની ધીંગી દીવાલો, સુલતાન મહમદ બેગડાને હાથે મરિજદમાં ફેરવાચેલી રડતી અને લાંગેલી છતાંય કંઈક કહેતી ઉપરકોટની રા’એંગારની હવેલી, ત્યાં વાગતા રાણુકદેવકીના રોમાંચક લાણુકારા, ત્યાં ટકરાઈને તૂટી પડેલી સત્તાઓનાં રુધિરથી અરડાયેલી તેની ધૂડનાં છુંાં : બસો ને ચાર તસુ જેટલી લાંખી અને ચારસો ને નેવું તસુ જેટલા ઘેરાવાવાણી અરખસ્તાનના સલીમાનના પુત્ર સુલતાન સુલેમાને પંદરમા સૈકામાં મિસરમાં બનાવેલી તેની નીલમ તોાપ-અનેકવિધ વારાફેરાએા વર્ચ્યે પણ જાજરમાન જૂનાગઢનો આવો ઉપરકોટ કેટલો અલિંગત અને કેવો અણુનમ ભિલો

રહ્યો ? અને કેટલી ખધી ચઠાઈએને તાણે થવા છતાંય પોતાનું સૈકાવેરું અરમાન, કેટલી અને કેવી રમ્ય છટાથી તે સાચવી રહ્યો ?

દામોદર અને પ્રાચીકુંડ જેવા જૂનાગઢના અનેક કુંડો, ગોરખથી માંડીને દાતાર સુધીનાં તેનાં ઘણુંય સુરમ્ય શિખરો, નેમીનાથ અને અંધામાતા જેવાં તેનાં અનેક મંહિરો, દમામહાર મર્સિજદો, શૈનકહાર મકખરાએઓ, નદીએઓ અને નેસડાએઓ, ગીર જેવાં જંગલો અને આખા એશિયાના એ જંગલોમાં વસતા એકલા વનરાણે-કસણીએઓ જડે તો કસણની સામથ્રીનો હુકાળ જૂનાગઢને જરાય નડતો નથી.

પણ એક વિશિષ્ટ આકર્ષણું કરનારી વાત તો હજુ પણ ખાકી જ રહી. સાહિત્યની હુનિયામાંયે જૂનાગઢ પોતાના નામની એક અમર કોતરણી કરી. લક્તાકવિ નરસિંહ જૂનાગઢની ભત્તા હતો. ચુજરાતી ભાષાને કવિતાનો કંઠ આપનારો જૂનાગઢનો નરસૈયો હતો. અને નરસૈયાનું રચેલું, ગાંધીજીએ ગાયા પછીથી આપણી હુનિયાના કરોડો માનવીએના કંઠમાં મઢાઈ ગયેલું ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ તું જગપ્રસિદ્ધ કાંય પણ જૂનાગઢની સાહિત્યરસિક ભૂમિને માથે જ પ્રકટયું હતું. અહીંથી થોડેક દૂર

વસેલા કાઠિયાવાડના નંદનવનસમા ચોરવાડમાં પણું સાહિત્યનો અગ્રીચો હળુ તો ગઈ કાલ સુધી ફૈરલો હતો. ‘સ્વગ’ નાં પુસ્તકોના લોકપ્રિય કર્તાં અમૃતલાલ પદ્ધિયારની મંડળી રમણીય ચોરવાડમાં હળુ તો હમણું જ વસતી હતી. આવું રણિયામણું જૂનાગઢ છે.”

જૂનાગઢમાં સાહિત્ય પરિષદનું અધિવેશન મળ્યું ત્યારે સ્વાગત-પ્રમુખ તરીકેના વ્યાખ્યાનમાં શ્રી શામળદાસ ગાંધીએ જૂનાગઢનો પરિચય ઉપરના શાખામાં આપ્યો હતો.

જે સ્થાને જૂનાગઢ છે તે સ્થાને અથવા તેની નજીકમાં પ્રાચીનકાળથી વસાહતો હશે એમ તો લગભગ બધા જ ઈતિહાસકારો સ્વીકારે છે. શ્રી જયસુખરાય જેષીપુરાએ ‘ગૌરવ’ નામના પુસ્તકમાં લખ્યું છે: “આ શહેરને આદિ કાળમાં મણિપુર, સ્મૃતિકાળમાં ચંદ્રકેતુપુર, પછી રેવતનગર અને કણિકાળમાં પુરાતનપુર પણું કહેતા હતા.” આ અતાવે છે કે અહીં પુરાતનકાળમાં પણું નગરો હતાં. આ પછીના કાળમાં આ સ્થળનાં નગરને વિવિધ નામો મળ્યાં છે. ઈતિહાસના ઘણા વારાફેરા આ નગરે જોયા છે. એની સમગ્ર કથાનું નિરૂપણ કરીએ તે પહેલાં નર્મદ અને નહાનાલાલે એને વિષે જે નોંધ આપી છે તે જેઈ લઈએ.

નમ્રે ‘ગુજરાત સર્વ્સંગ્રહ’માં તેને વિશે નીચેની નોંધ આપી છે :

“જુનાગઢ શહેર ધણું પુરાતન છે. એનું જૂનું નામ જુણુંહર્ગ હતું. એ ગૃહ્યત રાજયોના હાથમાં હતું ત્યાર પછી ચુડાસમાના હાથમાં ગણું. એ ચુડાસમા રાજયોમાં સૌથી પ્રખ્યાત ને છેલ્દો રાજ રા’મંડળિક હતો. તેના ઉપર અમહાવાદનો બાહરાહ સુલતાન મહમદ ચઠી આવ્યો ને જુનાગઢ લઈ પોતાના રાજમાં જેડી દીધું ત્યારથી તે અમહાવાદના રાજની પડતી થઈ ત્યાં સુધી જુનાગઢનો રાજકારભાર અમહાવાદથી નીમાઈ આવતા મુસ્લિમાન થાણુદારો ચલાવતા. પછીથી અમહાવાદમાં હિલ્હીથી નીમાઈ આવતા સુખા રાજકારભાર કરતા ને જુનાગઢમાં હિલ્હીથી નિમાતા ઝૈજફાર કારભાર કરતા. સૌથી છેલ્દો ઝૈજફાર શેરખાન બાણી હતો. એ ૧૭૪૮ માં નવાખ એ ખિતાખ તથા બહાડુરખાન એ નામ ધારી સ્વતંત્રપણે રાજ્ય કરવા લાગ્યો. જેવાલાયક જગામાં નવાખનો મહેલ, જમાદાર સાલેહ હિંદીનું મકાન, શેર્ખ બાહઉદીનનું મકાન, મોહાખતચોક, ઇસ્તિપતાલ અથવા દરખારી મકાનો છે.”

કવિવર નહાનાલાલે જૂનાગઢનો પરિચય  
આપતાં લખ્યું છે :

“શ્રી કૃષ્ણના ને ચંદ્રગુપ્તના વારાનું પ્રાચીન શહેર છે. આપણા આદિ કવિ નરસિંહ મહેતા ત્યાં થયા; ઈતિહાસનાણી સતી રાણુકહેવડી જૂનાગઢની રાણી હતી. પાસે ગિરનારની પર્વતમાળ છે તે જોગીડ્રિપે જોગાકાર છે; ને વચ્ચે રવૈયા જેવું ગિરનારનું શિખર છે. એટલે પ્રાચીન કાળમાં ગિરનારને રેવત (રવૈયો) – રેવતાચળ કહેતા. રેવતના રાજની કુંવરી રેવતીજી શ્રી કૃષ્ણના વડિલ ભાઈ બળરામને પરણાંયાં હતાં. સોરઠનાં સપાઠ મેહાનો-માંથી ઓંચો રુહુલો છે તેથી ગિરનારને ઉજ્ઝ્વલનું પણ કહે છે. સામે દાતારની ટેકરી ઉપર જમિયલ પીરની જગા છે. ગિરનાર ઉપર દત્તાત્રીનાં પગલાં છે, જૈનોનાં ઢંડેરાસરો છે. ગિરનારમાં સિંહો રમે છે, તે સિંહોના સંગાથી ચોગીઓ રમતા. હમણું હમણું સિંહો એછા થયા છે, ને ચોગીઓ હેખાતા નથી. સુવર્ણગંગા-સોનરેખ નહી ગિરનારમાંથી નીકળી જૂનાગઢ કને થઈ વહે છે; એમાંથી સોનાની કણિકાઓ જડતી. સોનરેખને ખાંધીને મહારાજ ચંદ્રગુપ્તના સૂખાએ સુદર્શન સરોવર ખંધાંયું હતું. સુદર્શનની પાળે અશોક મહારાજે શિલાલેખ કેાતરાંયો હતો. આજે સુદર્શનને સ્થાને દામોકુંડ છે, ને શિલાલેખની મારગમાં મોટી શિલા પડેલી છે. પાસે રા'ખેંગારના ઉપરકોટનાં ખડેર છે. જૂના-

ગઠમાં રા'નું રાજ્ય હતું. ઈ. સ. ૧૪૭૧ માં અમદાવાદના ખાદ્યાહે છેલ્લા રા'મંડળિકને હરા-વીને જૂનાગઢ જીત્યું ત્યારથી ત્યાં મુસલમાની રાજ્ય છે. અમદાવાદના ખાદ્યાહેના ફોજદાર જૂનાગઠમાં રહેતા ને ખાદ્યાહી નઝર ઉધરાવતા. ઈ. સ. ૧૭૪૮ માં એ ફોજદાર સ્વતંત્ર નવાખ થયા. ઈસ્લામી રોનકના મકખરા જૂનાગઠમાં જેવા જેવા છે. જૂના-ગઠના ખાગ જેવા ખાગ ગુજરાતભરમાં બીજે નથી."

લગ્નાન કૃષ્ણે દ્વારકા વસાંયું ત્યારે આ પ્રદેશ પ્રસિદ્ધ તો હતો જ. પુરાણો કહે છે કે આનર્તાના પુત્ર રૈવતે કુશસ્થળી નામનું નગર વસાંયું હતું. આ કુશસ્થળી વિષે પુરાણોમાં જે ઉલ્લેખો છે તે બધા શ્રી ઉમાશંકર જેખીએ ‘પુરાણોમાં ગુજરાત’ માં એકત્ર કર્યા છે. સમુક્તાટે રૈવત પર્વત પાસે કુશસ્થળી હતું અને ત્યાં દ્વારકા વસ્યું એમ મહાભારતમાં કહ્યું છે. વધુમાં તેમાં કહ્યું છે કે રૈવત પુરદાર ભૂષણદ્વપ હતો અને તેની બધી ખાજુએ સમુક્ત હતો. રૈવતનો પિતા રૈવત આનર્તદેશ લોગવતો અને કુશસ્થળીમાં વસતો. પણ કુશસ્થળી નામ પ્રમાણુમાં પ્રાચીનકાળે ધાર્ણું પ્રચલિત હતું. એમ પુરાણોમાંના ઉલ્લેખો ઉપરથી લાગે છે. એટલે કુશસ્થળી અને કુશાવતી નામનાં નગરો અનેક સ્થળે હોય એવો સંભવ છે.

શ્રી હુગાંશાંકર શાસ્ત્રી માને છે કે રેવતક પર્વતની તળેટીમાં કુશસ્થળી વસ્યું હશે પછી એ જ સ્થાન ઉપર દ્વારકા વસ્યું હશે એવું અનુમાન • એ કરે છે. એટલે કે આજનું જૂનાગઢ જે સ્થાન ઉપર છે ત્યાં અથવા તેની નજીક કૃષ્ણનું દ્વારકા વસ્યું હશે એમ એ માને છે. વેદના સમયમાં આજે જ્યાં ગુજરાત છે ત્યાં જંગલો હતાં. એ પછી તો આ પ્રહેશમાં સ્થળ-જળના અનેક ફેરફારો થયા હશે. એ કાળે વસાહતો તો સાગર-તીરે હશે. અંદરના પ્રહેશમાં આહિવાસીએ વસતા હશે. એવા પ્રાચીનકાળમાં રેવતાચળની તળેટીમાં સૌથી પ્રથમ કુશસ્થળી વસ્યું હશે. અને એ જ સ્થાન ઉપર યાદવોએ આવીને દ્વારકા વસાંયું હશે એવી એમની અટકળ છે.

લગભગ આ જ અરસામાં સાગરકાંડે પ્રલાસ પાટણું વસ્યું હશે. શ્રી કૃષ્ણના દેહેતસર્ગ પછી જે કાખાએએ કૃષ્ણની સ્ત્રીએનું હરણ કર્યું હતું એ કાખાએએ મૂળ તો યાદવવંશના જ હોય એવો સંભવ છે.

ગિરનારની તળેટીને પ્રહેશ એ પ્રાચીન કાળમાં પણ ઇણદ્રુપ તો હતો જ. એટલે લાંબા સમય સુધી એ સ્થળ ઉજ્જ્વલ તો ન રહે.

નહોના અને મૌર્યોના યુગમાં આપણે

આવીએ છીએ ત્યારે ત્યાં એક નગર વસેલું જ છે. ચંદ્રગૃહેત મૌર્યના જમાનામાં ગિરિનગરનો ઉદ્દેખ છે. એ પછી સતત એ સ્થળે નગર રહ્યું છે. એમાં ઝ્યાંતર થતાં થતાં આજનું જૂનાગઢ વિકાસ પામ્યું છે.

આ સ્થાનનો મહિમા ઈતિહાસની હૃષિએ ધણો મોટો છે. ઈતિહાસના અનેક યુગોની નિશાનીઓ આ સ્થળે જળવાયેલી આપણુંને મળે છે. ભર્ય અને એવાં ખીલં ધણું પ્રાચીન સ્થળો ગુજરાતમાં છે. પણ એ સ્થળોએ આઠલા પ્રાચીનકાળના ઈતિહાસની નિશાનીઓ મળતી નથી. એટલે તો કવિવર નહાનાલાલે આ સ્થાનને ઉદેશીને કહ્યું છે :

“હા ! કાલરાશિ સરિખા ગિરિ રાજતા તે,  
ને એક ભૂતકહા ત્યાં ચરણું પડ્યો ’તો :  
રાજેન્દ્ર કો થઈ ગયા સબ્ધિ ! ધર્મગોપા,  
તે કુલચન્દ્રની કથા ગુહાવન્તી ગાતો :  
શું સ્થૂલ-સૂક્ષ્મ લહરી નથી એક પૂરે ?  
શું સ્થૂલ નેત્ર નવચેતન મન્ત્ર વાંચે ?  
શું સૂક્ષ્મની ન વસી સુન્દરતા સ્થૂલોમાં ?  
શું સ્થૂલમાં ન ઊભરાય અદ્દય સૂક્ષ્મ ?  
નોયું અમે ગિરિકણે, સ્થૂલની શિલામાં  
નોયું અમે જ ઊંડું, અદ્ભુત માંહી દીકું :

એ એક શૈલકણું ઉર લેદી જેતાં  
ઇતિહાસવાહી લીધ દર્શાન રહ્યાં પ્રલુનું.”

જૂનાગઢમાં ગિરનાર તરફ જવાનો રસ્તો  
વાધેશ્વરીના દરવાજથી નીકળે છે. એ રસ્તા ઉપર  
જમણું હાથે એક મોટા ખડક ઉપર ત્રણ મહત્વના  
શિલાલેખો કોતરેલા છે. તેમાં પહેલો શિલાલેખ  
અશોકનો છે. જૂનાગઢથી લગભગ એક માઇલના  
અંતરે આ ખડક આવેલો છે. તેમાં અશોકનાં  
પ્રસિદ્ધ ચૌદ શાસનો છે. જમીનની સપાઠીથી બાર  
કૂટ જાંચો અને નીચેના લાગમાં પંચાતેર કૂટ પરીધ-  
વાળો આ ચેનાઈનો ખડક છે. તેમાં અશોકનો  
શિલાલેખ સો ચોરસકૂટથી વધુ સપાઠી ઉપર પથરા-  
યેલો છે. અશોકના શિલાલેખ ઉપરાંત આ ખડક  
ઉપર બીજી એ લેખો પણ કોતરાયેલા છે. એમાંનો  
એક મૌર્ય રાજ ચંદ્રગુપ્તના પ્રાંતિક સૂખા વૈશ્ય  
પુષ્યગુપ્તે બંધાવેલા સુદર્શાન તળાવના સમારકામ  
સંબંધી મહાક્ષત્રપ તુદ્રામનના સમયનો છે. બીજે  
લેખ ગુપ્તરાજ સ્કંદગુપ્તના સમયનો છે અને  
સુરાધ્રના સૂખા અને પર્ણદત્તના પુત્ર ચક્રપાલિતે  
ઈ. સ. ૪૫૬-૫૭માં કરાવેલા વિશેષ સમારકામ  
સંબંધી છે.

અશોકનો લેખ ખડકની ધિશાન બાજુ

ઉપર છે. મેજર જેમ્સ ટોડ ઈ. સ. ૧૮૨૨ના ડિસેમ્બરમાં ગિરનાર ઉપર ગયો હતો ત્યારે આ લેખ આભાદ સ્થિતિમાં હતો. એ પછી જૂનાગઢથી ગિરનાર જવાનો બંધ બાંધતી વખતે સુરંગ ફ્રેઝટાં અશોકના પાંચમા અને તેરમા શાસનોના અમુક ભાગ ઊડી ગયા હતા. અત્યારે તો આ લેખવાળા ખડકની સાચવણી પુરાતત્ત્વભાતુ કરે છે. તેના ઉપર મકાન બાંધવામાં આંધું છે અને તેની સાચવણી પ્રમાણુમાં ઠીક થાય છે.

અશોકનાં આ ધર્મશાસનોનું ઐતિહાસિક મહત્વ ઘણું છે. એમાંથી કેટલીક ઉપયોગી માહિતી પણ મળે છે. એમાં જે ખંડિત શાસનો છે તે છાડી દઈને ખાકીનાં શાસનોને અનુવાદ શ્રી ગિરિજન-શાંકર વદ્દલભજી આચાર્ય કૃત ‘ગુજરાતના ઐતિહાસિક લેખો’માંથી અહીં ઉતારીએ છીએ :

### શાસન ૧ દ્વં

અ આ નીતિલેખન દેવોના પ્રિય પ્રિયદર્શી રાજએ લખાવેલ છે.

અ આહી કોઈ પણ જીવતા પ્રાણીને મારવું નહીં, તેમજ હોમવું નહીં.

ક અને કોઈ પણ ઉત્સવસંમેલન લરવું નહીં.

- ૩ કારણુ કે દેવોના પ્રિય પ્રિયદર્શિં રાજ ઉત્સવ-  
સંમેલનોમાં બહુ દોષ જુદે છે.
- ૪ પણ વળી કેટલાંક એવાં ઉત્સવસંમેલનો છે કે જે  
દેવોના પ્રિય પ્રિયદર્શિં રાજથી સારાં મનાયાં છે.
- ૫ પૂર્વે દેવોના પ્રિય પ્રિયદર્શિં રાજના રસોડામાં  
સૂપ અનાવવા માટે ધણું લાખ પ્રાણીઓ રોજ  
મારવામાં આવતાં હતાં.
- ૬ પણ હવે જ્યારે આ નીતિલેખન લખાયું છે ત્યારે  
સૂપ માટે માત્ર ત્રણુ પ્રાણી મારવામાં આવે છે; એ  
મોર અને એક હરણુ; વળી આ હરણુ પણ  
હર્મેશ નહીં.
- ૭ આ ત્રણુ પ્રાણીઓ પણ અનિષ્ટમાં મારવામાં  
આવશે નહીં.

### શાસન બીજું

આ દેવોના પ્રિય રાજના (જીતેલા) પ્રહેશોમાં બધે  
તેમજ સરહદ ઉપરના રાજાઓ જેવા કે ચોડ,  
પાણપદ્ય, સંતિયપુત, કેતલપુત તેમજ તામ્રપણીં  
અને ચોનરાજ અંતિભક અને વળી આ અંતિયકની  
પડાશમાં જે રાજાઓ છે તેમાં બધે દેવોના પ્રિય  
રાજથી એ પ્રકારની ચિકિત્સા સ્થાપવામાં આવી:  
માણુસની ચિકિત્સા અને પણુની ચિકિત્સા.

૪ અને જયાં જયાં મનુષ્યોપયોગી અને પશૂપયોગી ઔષધો નહોતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યાં અને રોપાવવામાં આવ્યાં.

૫ જયાં જયાં મૂળો અને ઝૂળો નહોતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યાં અને રોપાવવામાં આવ્યાં.

૬ પશુ અને મનુષ્યના ઉપયોગ માટે રસ્તાએ ઉપર ફૂવાએ ખોદાવવામાં આવ્યા અને આડો રોપાવવામાં આવ્યાં.

### શાસન ચીનું

અ દેવોના પ્રિય રાજ આ પ્રમાણે ઓલે છે.

૭ રાજ્યાભિષેક થયાને બાર વર્ષ થયાં ત્યારે મહારાથી નીચેનો હુકમ કાઢવામાં આવ્યો:

૮ દરેક પાંચ પાંચ વર્ષો મહારા પ્રદેશોમાં બધે ચુક્તા રાજૂક અને પ્રાદેશિક સંપૂર્ણ મુસાફરીએ નીકળશે અને તે આ હેતુ માટે (એટલે કે) નીચેના નીતિ-શિક્ષણ માટે તેમજ ધીન કામકાજ માટે :

૯ માતા અને પિતા તરફ સુશ્વષા સારી છે. ભિત્ર, ઓળખીતા, સંખંધી, ખાદ્યાણ અને શ્રમણ તરફ ઉદાર વૃત્તિ સારી છે. પ્રાણીઓની અહિંસા સારી છે, ઓછો ખર્ચ અને ઓછું સંધરવું સારું છે.

૬ (આ નિયમો) હેતુપુરઃસર અને અક્ષરશઃ નોંધવા માટે પરિષદ પણુ 'ચુક્તા' ને ફરમાવશે.

### રાસન ચોથું

આ પૂર્વ સમયમાં ઘણાં સૈકાં સુધી પ્રાણીઓનો વધ અને જીવોની હિંસા નિરંતર વધતી જતી હતી. (તેમજ) શાતિજન તરફ અવિવેક અને પ્રાણણુ અને શ્રમણુ તરફ અવિવેક (પણ વધ્યો જતો હતો).

૭ પણ હવે દેવોના પ્રિય રાજની નીતિચર્ચાને લીધે ઢાકનો અવાજ હવે નીતિનો અવાજ (થયો છે). કોકેને વિમાન, હાથીઓ, અજિનસમૂહ અને ખીજાં દિંય ઝેપો અતાવીને.

૮ ઘણાં સૈકાં સુધી પૂર્વે અસ્તિત્વમાં નહોતાં એવાં હવે દેવોના પ્રિય રાજના નીતિશિક્ષણુને લીધે પ્રાણીઓના વધનો અટકાવ, જીવોની અહિંસા, શાતિજન તરફ વિવેક, માતાપિતાની સેવા, પ્રાણણો. અને શ્રમણો તરફ વિવેક, અને વૃદ્ધની સેવા (એ બધાં) વધ્યાં છે.

૯ આ અને ખીજ ઘણી રીતે નીતિચર્ચા વધી છે. અને આ નીતિચર્ચા દેવોના પ્રિય રાજ હમેશાં વધારશે.

૧૦ દેવોના પ્રિય રાજના પુત્રો, પૌત્રો અને પ્રપૌત્રો આ નીતિચર્ચાને પ્રલયપર્યંત વધારશે. નીતિ અને શીળ પાળીને નીતિનું શિક્ષણ આપશે.

૬ આ નીતિનું શિક્ષણ તે શ્રેષ્ઠ કામ છે.

૭ શીલ વિનાના પુરુષ માટે નીતિચર્ચા હોતી નથી,  
તેટલા માટે આ અર્થની વૃદ્ધિ અને અનુણુપ સારી છે.

૮ નીચેના હેતુ માટે આ લખવામાં આવેલ છે. એટલે  
કે આ આચરણની વૃદ્ધિ ચોજવી અને તેની હાનિ  
પસંદ કરવી નહીં.

૯ દેવોના પ્રિય રાજાએ, અલિષેકને બાર વર્ષ થયે  
લખાવેલ છે.

### શાસન ૬ હું

અ દેવોના પ્રિય રાજ આ પ્રમાણે કહે છે:

૩ ભૂતકાળમાં કામનો નિકાલ તેમ જ અહેવાલ રજૂ  
કરવાનો (રિવાજ) પૂર્વે અસ્તિત્વમાં નહોતો.

૫ પણુ (તેથી) મહેં આ પ્રમાણે ગોડવણુ કરી છે.

૩ હું જમતો હોઉં અગર જનાનામાં હોઉં અગર  
અંદરના ઓરડામાં હોઉં અગર ગોશાળામાં, પાલખીમાં  
કે વાડીમાં હોઉં ત્યાં બધે પ્રજનું કામકાજ ગમે  
ત્યારે મહને નિવેદન કરવા માટે અખર આપનારાએા  
રાખવામાં આવ્યા છે.

એ બધે ઠેકાણે પ્રજનું કામકાજ કરું છાં.

૬ હું જે મોઢેથી દાન અગર દંદેરાનો હુકમ કરું તે  
સંખ્યી તેમજ જે તાકીદની બાખત મહામાત્રોને

સેંપવામાં આવી હોય તે સંખંધી પરિષદમાં વિવાહ થાય અગર સુધારો સૂચવવામાં આવે તો ગમે તે વખતે ગમે ત્યાં તે મહને નિવેદન કરવું જેઈએ.

ગ એમ મહેં હુકમ કર્યો છે.

હ કારણુ કે કાર્યનો નિકાલ કરવામાં અને (તે સંખંધી) શ્રમ લેવામાં મહને કદિ સન્તોષ થતો નથી.

ઇ બધા લોકોનું હિત એ મહાંકું કર્યાં ય માનું છઉં.  
જ પણ તેનું ભૂળ શ્રમ લેવો અને કાર્યનો નિકાલ છે.  
ક બધા લોકોનું હિત જળવવા માટે બીજું કોઈ બધારે ઉપયોગી કાર્ય નથી.

લ હું જે પ્રયાસ કરું છઉં તે એટલા માટે કે હું પ્રાણી-  
ઓના કરજમાંથી મુક્તા થાડું, આ સંસારમાં તેમને  
હું સુખ આપું અને પરલોકમાં તેઓ સ્વર્ગ મેળવે.

મ આ હેતુ માટે આ નીતિશાસન લખાવવામાં આવ્યું  
છે કે તે લાંબો વખત ટકે અને મહારા પુત્રો, પૌત્રો  
અને પ્રપૌત્રો બધા લોકના હિત માટે આ પ્રમાણે વર્તો.

ન ઉચ્ચ પરાક્રમ સિવાય આ હુંકર છે.

### શાસન ૭ મું

અ હેવોના પ્રિય રાજ ઈચ્છે છે કે બધા પન્થો બધે  
વસવા જેઈએ.

અ તે બધા સંયમ અને માનસિક શુદ્ધિની અપેક્ષા રાખે છે.

ક પણ મનુષ્યો જીંચી નીચી તૃપ્તિએ અને આવેશો ધરાવે છે.

ક કાં તો તેઓ બધી (તૃપ્તિ) પરિપૂર્ણ કરે છે અગર અમુક અંશે સકળતા મેળવે છે.

ઈ વિપુલ દાન કરનારામાં જો સંયમ, માનસિક શુદ્ધિ, કૃતજ્ઞતા અને હૃદ લક્ષ્ણ ન હોય તો (તે) બહુ જ નીચો છે.

### શાસન ૮ સું

અ ભૂતકાળમાં રાજનો વિહારયાત્રા કરવા નીકળતા.

અ તેમાં મૃગયા અને બીજી તેવી મળનો (સોંગવાતી) હતી.

ક પણ જ્યારે દેવોના પ્રિય રાજને અલિષેક થયાને દસ વર્ષ થયાં ત્યારે તે સંખોધિ(ભુદ્ધ ગયા)એ ગયો.

ક તેથી આ ધર્મયાત્રા (શરૂ કરાઈ).

ઈ આમાં નીચે પ્રમાણે થાય છે. ખાલ્સાણુ અને શ્રમણુનાં દર્શન, (તેઓને) દાન, વૃદ્ધોનાં દર્શન અને સોનાથી પોષણ, ગામડાંઓનાં માણુસોનાં દર્શન, (તેઓને) ધર્મનું શિક્ષણ અને પ્રાસંગિક ધર્મસંબંધી પ્રક્રિયાનું.

કે હેવોના પ્રિય રાજના (રાજયના) આ ખીજા લાગથી ધ્યાણી પ્રીતિ ઉત્પન્ન થાય છે.

### શાસન દુસું

આ હેવોના પ્રિય રાજ આમ કહે છે.

અ મંદ્વાડમાં, પુત્ર તેમ જ પુત્રીનાં લગ્નમાં, પુત્રજનમ વખતે તેમ જ યાત્રાએ જતી વખતે માણુસો જૂદી જૂદી વિધિઓ કરે છે.

ક પણું આ પ્રસંગે સ્ત્રીઓ બહુ અને બહુનાતની કુર્દ અને નિરર્થક વિધિઓ કરે છે.

ક હુવે વિધિઓ કરવી જોઈએ.

એ પણું આ જાતની વિધિ અદ્વય કૃળવાળી છે.

કે પણું નીચેની વિધિ એટલે કે ધર્મ સંભંધી વિધિ બહુ કૃળવાળી છે.

ગ તેમાં નીચેની વિધિનો (સમાવેશ થાય છે). ગુલામ અને નોકરોને યોગ્ય સહ્યતા, વૃદ્ધ્યા તરફ પૂજ્ય-ભાવ, પ્રાણીઓ તરફ સંયમ અને આદ્યાણુ અને શ્રમણ તરફ દાનવૃત્તિ. આ અને એવી ખીજ વિધિ ધર્મવિધિ કહેવાય છે.

ક તેરલા માટે પિતા, પુત્ર, ભાઈ અગર સ્વામીઓ કહેવું જોઈએ કે આ સારું છે, હેતુ પાર ખડે ત્યાં સુધી આ વિધિ કરવી જોઈએ.

ઈ અને એમ પણું કહેવામાં આવ્યું છે કે દાન દેવું તે સારું છે.

જ ધર્મનું દાન અને ધર્મના અનુશ્રદ્ધ જેવું ખીણું એકે દાન અનુશ્રદ્ધ નથી.

ક તેટલા માટે ભિત્ર, સુહૃદ્ય જ્ઞાતિજ્ઞ અને સોખતીએ તે તે પ્રકરણુમાં (ખીણને) ટોકવાં જોઈએ કે આ કરવું જોઈએ, આ સારું છે, આ કરવાથી સ્વર્ગ મેળવવું શક્ય છે.

લ અને સ્વર્ગ મેળવવા કરતાં ખીણું વધારે શું ઈષ છે.

### શાસ્ત્રન ૧૦ સું

અ હમણું અને લવિષ્યમાં રહારી પ્રજા ધર્મ સેવે અને ધર્મવ્રતનું પાલન કરે તે (સેવા અને પાલન) સિવાય યશ અને કીર્તિનો કાંઈ રહેઠો ફાયદો નથી.

અ આ માટે દેવોના પ્રિય રાજુ યશ અને કીર્તિની ઈચ્છા રાખે છે.

ક પણું કે પ્રયત્ન દેવોના પ્રિય રાજુ કરે છે તે બધો પરલોક માટે છે કે જેથી બધાં માણુસ એછો ભય એડે.

ઃ પણું ભય આ છે, એટલે કે અપુષ્ટયત્વ.

ઈ પણું ક્ષુદ્ર તેમ જ ઊંચા માણુસથી ધણી જ ખંત

અને બીજું ખધું તળ દીધા વિના આ (સાધવું)  
હુષ્કર છે.

૩ પણ ઉચ્ચ માણુસને માટે આ ખાસ હુષ્કર છે.

### શાસન ૧૧ સું

અ હેવોના પ્રિય રાજ આમ કહે છે :

અ ધર્મના દાન જેવું બીજું દાન નથી, ધર્મ (ક્ષારા) ઓળખાણુ જેવી બીજુ ઓળખાણુ નથી, ધર્મની લહાણી જેવી બીજુ લહાણી નથી, અને ધર્મ (ક્ષારા) સંખન્ધ જેવો બીજે સંખન્ધ નથી.

૪ તેમાં આનો સમાવેશ થાય છે.—દાસ અને નોકરો તરફ સમલાવ, માતા અને પિતાની સેવા, ભિત્ર, ઓળખિતા અને સંખન્ધી, પ્રાણીએ અને શ્રમણ તરફ ઉદ્ધારતા અને પ્રાણીની અહિંસા.

૫ આ ખાખતમાં પિતા, પુત્ર, ભાઈ, ભિત્ર, ઓળખિતા, સંખન્ધી અને પાડોશીએ પણ કહેવું જોઈએ કે આ સારું છે, આ કરવું જોઈએ.

૬ તે પ્રમાણે જો (કોઈ) કરે તો આ લોકમાં સુખની પ્રાપ્તિ થાય છે અને તે ધર્મદાનથી પરલોકમાં પણ અનન્ત પુણ્ય થાય છે.

### શાસન ૧૨ સું

અ હેવોના પ્રિય રાજ ખધા પન્થોને માન આપે છે.  
સાધુને તેમજ ગૃહસ્થોને માન આપે છે, દાનથી

અને વિવિધ જાતની પૂજાથી માન આપે છે.

એ બધા પન્થોનાં સારભૂત તરત્વોની વૃદ્ધિના જેવાં ખીજાં  
એકે દાન અગર પૂજા માનતા નથી.

૫ તરત્વોની વૃદ્ધિ બહુ જાતની (હોય છે.)

૬ પણ તેનું ભૂળ ઓલવામાં સંભાળ એ છે. (એટલે  
કે) પ્રસંગ વગર પોતાના પન્થની પ્રશંસા અગર  
ખીજાના પન્થની નિંદા ઉદ્ઘલબે નહિ અને પ્રસંગે  
પણ તે પ્રમાણુસર થાય.

૭ દરેક પ્રકરણુમાં ખીજાના પન્થોને માન આપવું જોઈ એ.

૯ એમ કરે છે તો પન્થની વૃદ્ધિ કરે છે અને ખીજાના  
પન્થના ઉપર ઉપકાર કરે છે.

૧૦ પણ જે અન્યથા વર્તે તો પોતાના પન્થને ધક્કો  
પહેંચાડે છે અને ખીજાના પન્થની ઉપર પણ  
અપકાર કરે છે.

૧૧ કારણ કે જે પોતાના પન્થને પૂજે છે અને ખીજાના  
પન્થને નિંદે છે અને તે બધું પોતાના પન્થ તરફની  
લક્ષિતને લીધે એટલે કે પોતાનો પન્થ કીર્તિ પામે  
તેવા હેતુથી તો તેમ કરવાથી પોતાના પન્થને ધણું  
દરજાને તુકસાન પહેંચાડે છે.

૧૨ તેટલા માટે સલાહસંપ્રક્રિયાણુકારક છે. એટલે કે  
એકખીજાનો ધર્મ સાંભળો અને ધર્મની આજા પાણો.

જ કારણુ કે દેવોના પ્રિય રાજાની એવી ધૂઢા છે કે બધા પન્થો બહુ જ્ઞાનવાળા અને કલ્યાણકારક મતવાળા હેવા જોઈ એ.

ક અને જેએ પોતપોતાના પન્થમાં પ્રસન્ન રહે છે તેઓને કહેવું જોઈ એ કે—

લ બધા પન્થોનાં સુખ્ય તત્ત્વોની વૃદ્ધિ જેટલાં દાન અગર પૂજને દેવોના પ્રિય રાજ ગણુત્તા નથી.

મ અને આ માટે બહુ અમલદારો રોકવામાં આય્યા છે જેવા કે નીતિના મહામાત્રો, સ્વીએને કાણુમાં રાખનારા મહામાત્રો, ગોશાળાની દેખરેખ રાખનારાએ અને બીજા દરજાના અમલદારો.

ન અને તેનું ઝલ આ છે. પોતાના પન્થની વૃદ્ધિ થાય છે અને ધર્મની કીર્તિ (વધે છે).

### શાસન ૧૪ સું

અ આ ધર્મલિપિએ દેવોના પ્રિય રાજએ સંક્ષિપ્ત, મધ્યમ, અગર વિસ્તૃત સ્વરૂપમાં લખાવી છે.

ખ અને તે આખી બધે અનુકૂળ નહોતી.

ક મહારું રાજ્ય વિસ્તારવાળું છે. બહુ લખાયું છે, અને હજુ બહુ લખાવાશે.

ડ અને તે તે અર્થની મધુરતાને લઈને આમાંથી કેશુંક ઝરી ઝરી કહેવાયું છે. તેથી લોકો તે પ્રમાણે વર્તે.

કી દેશને લઈને અગર મહારો હેતુ ન પસંદ પડવાથી અગર લેખકના હોષથી આમાંનું કેટલુંક કેટલીક જગાએ અધૂરું લખાયું છે. ”

ગિરિનગરની આ ધર્મલિપિમાં ગુજરાતી સાંસ્કારને ઘડનારું સૌથી પહેલું ઈતિહાસસિદ્ધ બળ છે. આપણા લોકજીવનમાં સાંસ્કારિક વારસારૂપે જીતરી આવેતાં ધણાં લક્ષણોનાં ખીજ એમાં મળે છે. ગુજરાતની પશુહ્યાની લાવના, પશુએની માવજત કરવાની અને સવિશેષ ઝોડાં ઠોરને સાચવવાની પ્રથા, વાવ-કૂવા કરાવવાની ગુજરાતની જરૂર, દાનની પ્રથા અને સર્વધર્મસમલાવની લાવના અહીં રૂપી રૂપી સ્વરૂપે દેખાય છે.

મૌર્યકાળમાં સૌરાષ્ટ્રમાં એવી ક્ષત્રિય જાતિએ હતી કે જે એતી, પશુપાલન અને શાખ દ્વારા પોતાનું ગુજરાન ચલાવતી.

અશોકના સમયમાં જેમ સૌરાષ્ટ્ર-આનર્ટામાં ઔર્ધ્વસંપ્રદાય પ્રચાર પામ્યો હતો તેમ તેના ઉત્તરાધિકારી સંપ્રતિના સુમયમાં જનસંપ્રદાય ફેલાયો હતો.

આ શિલા ઉપર ખીંદે મહત્વનો લેખ રૂપ્રદામનનો છે. એ અગિયાર કૂટ એક ઈચ્છ પહોળો અને પાંચ કૂટ પાંચ ઈચ્છ જીંચા છે. તેમાં

વીસ પંક્તિ છે. આમાંની છેલ્લી ચાર પંક્તિઓ જ ખરાખર સચ્ચવાયેલી છે. બાકીની બધી પંક્તિઓ માંથી કેટલોએ કેટલોએ ભાગ ઘસાઈ ગયો છે. આ લેખની લાખા સંસ્કૃત છે. તે ગધમાં છે. જે સુદર્શન તળાવ પાસે આ લેખ કોતરાયેલો છે તેને મહાક્ષત્રપ રુદ્રદામાએ હુરસ્ત કરાયું હતું તે હકીકત નોંધવાનો આ લેખનો આશય છે.

ઇ. સ. ૧૫૦ની ૧૬મી નવેમ્બરે બંધનું ખાંધકામ પૂરું થયું હતું એમ જણાય છે. આ લેખમાં ગિરિનગરનો ઉલ્લેખ છે, ઉર્જયત પર્વતનો ઉલ્લેખ છે અને સુવર્ણસિક્તા અને પદાશિની એવી એ નદીઓનાં તેમાં નામ છે.

અશોક પછી અહીં કેનું શાસન હશે તે ચ્ચાઙ્ગસ કહી શકતું નથી. પણ ઇ. સ. પૂર્વે ૧૮૦ થી ઇ. સ. ૧૦૦ સુધી અહીં યવનોનું રાજ્ય હોય એવો સંભવ છે. એ બધા સમય દરમિયાન ગિરિનગરમાં રાજ્યાની રહી લાગે છે. અશોકના સમયમાં યવનરાજ તુખાર્ય ગિરિનગરનો સૂઝો હતો. એ પછીના સમયમાં યવનોની સત્તા અહીં ટકી રહી હોય અને તેથી તેને યવનહુર્ગ એવું નામ મળ્યું હોય એ શક્ય છે.

એ પછી અહીં ક્ષત્રપોનું રાજ્ય સ્થપાયું.

એ ક્ષત્રપોમાં મહાક્ષત્રપ રુદ્રદામા આવ્યો. તેનું વર્ણન આ લેખમાં છે. તેમાં કહ્યું છે : “તેનામાં રાજલક્ષ્મી ધારણુ કરવાના શુષ્ણુને જોઈને સર્વે વર્ણુંએ જઈને રક્ષણુ માટે તેની ‘પતિ’ એટલે પાલક તરીકે વરણી કરી. આ રાન્નાએ પુરુષવધ ન કરવાની પ્રતિજ્ઞા કરી હતી, અને તે પાળી હતી. તેણે સામે આવેલા સમોવડિયા શત્રુને પ્રહાર કરવાનું ન ચુક્યા છતાં કરુણા ખતાવી હતી.” રુદ્રદામાએ વ્યાકરણુ, અર્થશાસ્ત્ર, સંગીત, ન્યાય વગેરે મહાન વિદ્યાઓ મેળવી હતી. અશ્વચચર્યા, ગજચચર્યા, રથચચર્યા અને ઢાલ-તલવાર તેમજ બાહુચુદ્ધમાં તેણે પ્રાવિષ્ય મેળંયું હતું એવો ઉલ્લેખ આ લેખમાં છે.

ઈ. સ. ૧૫૦માં એટલે શક સંવત બોંતેરના માગશર વદ ૧ ને દિવસે ગિરિનગરમાં અતિવૃષ્ટિ થઈ. પરિણુમે બધે જાણે મહાસાગર હોય એવાં પાણી ભરાઈ ગયાં. સુવર્ણસિક્તા, પતાશિની વગેરે નહીંઓમાં પૂર આવ્યાં અને સુદર્શન તળાવનો બંધ તૂરી ગયો. તેથી તળાવ ખુલ્લું થઈ ગયું. તળાવનું ખધું પાણી વહી ગયું. પ્રજામાં નિરાશા વ્યાપી ગઈ. ત્યારે પદહું સુવિશાળે બંધ બંધાવ્યો.

આ સુવિશાળનો પરિચય લેખમાં આપવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે : “આ અધ-

જીાનમાં એવું ગિરિન્ગરમાં પૌર અને જાનપદ જનો  
કહેતાં શહેરી અને ગામડાના લોકોના હિત માટે  
આખા આનત્ત્વ—સુરાજ્યના પાલન માટે નિયુક્ત થયેલા  
કુલૈપના પુત્ર સુવિશાખ પદ્ધતે” ખીજ અમાત્યો  
જ્યારે સફળ રીતે કામગીરી બજવી નહિ શક્યા  
હોય ત્યારે રૂદ્રદામાચે આ સુવિશાખને અહીં મોક-  
દ્યો હશે. એ શક્તિ, દાંત, સ્થિર, નિરભિમાની આર્થ  
હતો. અર્થ અને ધર્મનો ચોગ્ય વ્યવહાર કરીને તેણું  
લોકપ્રિયતા મેળવી અને પોતાના રાજનાં ધર્મ, કીર્તિ  
અને યશ વધાર્યાં.

મૌર્યો અને રૂદ્રદામા વચ્ચે સૌકાઓનો  
સમય વીત્યો હતો. એ અધા સમયનો સુદર્શન  
તળાવનો ધતિહાસ લેખોમાં અને રાજ્યના દસ્તાવેલો-  
માં સચવાયો હતો. રૂદ્રદામાચે સુદર્શનનું આખું  
ખાંધકામ કરીને કરાયું હતું. લેખ કહે છે : “મૌર્ય  
રાજ ચંદ્રગુપ્તના રાજ્ય વૈશ્ય પુરુષગુપ્તે કરાવેલું,  
અશોક મૌર્યના યવનરાજ તુથાસ્પે અધિષ્ઠાન કરી-  
અમલ કરી પ્રાણાલિઓથી અને રાજને અનુરૂપ જેનું  
વિધાન છે તેવું.”

એક ઉલ્લેખપાત્ર હકીકત એ છે કે રૂદ્ર-  
દામાચે આ તળાવ વેકથી કે નવા કરવેરા નાખીને  
ખાંધાયું ન હતું. તેને માટેનો ખદો ખર્ચ રાજ્યના

કેશમાંથી કરવામાં આવ્યો હતો. આ કામ વધુ પડતા સમયમાં થયું ન હતું. મૂળ બંધ કરતાં નવો બંધ ત્રણુગણો પહોણો, ત્રણુગણો લાણો અને ત્રણુગણો મજબૂત હતો. લેખના આરંભમાં તળાવ-તું વર્ણન છે.

“આ તળાવ સુદર્શન મોટા ઉપચયમાં વર્તે છે. અર્થાત્ છલાછલ છે. તે ગિરિનગરથી (પદીનો ભાગ તૂટી ગયો છે. એ હોત તો નગરથી કેટલે ફર અને કઈ દિશામાં તે છે એ ખખર પડત.) બધી પાળો પહોળાઈ લાંબાઈ અને ઊંચાઈમાં પદ્ધતાથી એવી રીતે બાંધેકી છે કે તેમાં સાંધો ન રહે તેથી અકૃતિમ-કુદરતી પર્વતપાદની સ્પર્ધા કરે એવા સેતુઅન્ધથી તળાવ ઉપપત્ર સજજ છે. સુધ્યવસ્થિત પ્રણાલીએ, પરિવહાણ અને કચરાથી બચવાના ઉપાયો—ગ્રિસ્કન્ધ અને અમુક અનુષ્ઠાન—અગવડોથી મોટા ઉપચયમાં સુદર્શન તડાગ વર્તે છે.”

ક્ષત્રપકાળમાં ગિરિનગરમાં જૈન અસર પણ ઠીક ઠીક હશે એમ સ્તુતવતો એક ખંડિત શિલાદેખ પણ ગિરિનશાંકર આચાર્યના અંથમાં મળે છે. શ્રી લોઙીલાલ સાંડેસરાએ ‘જૈન આગમોમાં ગુજરાત’ નામના અંથમાં ગિરિનગર વિશેના ઉલ્લેખોનો સંશોધ કર્યો છે. ગિરિનગરમાં એક અગિનપૂજક વણુક

રહેતો. એ વણિક એક ઘરમાં રતનો ભરીને તેને સળગાવી દઈ અગ્નિનું તર્ફણું કરતો અને તેથી એક વખત આખા નગરને આગ લાગી હતી એવી એક કથા આવશ્યક ચૂછ્યું માં છે. બીજુ પણું કેટલીક કથાઓ છે.

રુદ્રદામા પછી લગભગ બાવીસ ક્ષત્રપ રાજાએ થઈ ગયા. એમના સમયમાં રાજ્ય મોટું થતું ગયું અને એ આખા રાજ્યનું પાટનગર ગિરિનગર રહ્યું. અવન્તી, અન્નપ, આનર્ત-સુરાજ્ય, સ્વભ્ર, મરુ, કુચ્છ, સિંહુ, સૌવીર, કુકુર, અપરાન્ત, નિષાદ વગેરે હેશો આ મહારાજ્યમાં સ્થાન પામતા હતા. દક્ષિણમાં દ્વર સુધી ગિરિનગરની આખું વર્ત્તિ હતી.

ગુપ્તવંશના ચંદ્રગુપ્ત બીજાએ ગુપ્તોની સત્તા તોડી પાડી. પછી પઞ્ચિમ ભારતનો અધ્યો પ્રદેશ ગુપ્તોના શાસન નીચે ગયો. પણ એ સમયમાંયે ગુજરાતની રાજ્યધાની તો ગિરિનગરમાં જ રહી હતી. આગળ આપણે એ મહત્વના શિલાલેખોનો ઉલ્લેખ કર્યો છે એ શિલાલેખો જે ખડક ઉપર છે તેના ઉપર ત્રીજો મહત્વનો શિલાલેખ ગુપ્તકાળનો છે. એ ગુપ્ત સંવત ૧૩૫ નો છે એને ડે. ઈ. સ. ૪૫૭-૫૮ નો છે. અતિવૃદ્ધિ, સુદર્શનનો નાશ અને તેનો પુનરુદ્ધાર એ આ શ્રોકનો વિષય છે. એગણ-

આલીસ શ્રોદેના એક સુંદર કાયમાં આ લેખ છે. એ લેખનું શીર્ષક ‘સુદર્શનતટાકસંસ્કાર અંથરચના’ એવું છે.

આ લેખની શોધ જેમસ પ્રિન્સેપે ઈ. સ. ૧૮૩૮ માં પ્રસિદ્ધ કરી હતી. ડૉ. લગ્વાનલાલ ધન્દજીએ કપડાં પર તેની છાપ ઉતારી હતી અને તે શિલાછાપમાં છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ લેખમાં ગિરિનગરનું વર્ણન પણ છે. એ લેખ જેતાં લાગે છે કે એ શહેર પર્વતની તળેટીમાં જ હોવું જોઈએ. આ લેખનું લખાણું દસ કૂટ પહોળી અને સાત કૂટ ગ્રણું દિય જાચી જગ્યામાં છે. લેખના પ્રથમ ભાગમાં ગુપ્ત રાજ સ્કંદગુપ્તનું વર્ણન છે. પછી લગ્વાન વિષણુની સ્તુતિ છે. એ પછી રાજ્ય-કર્તાઓની પ્રશંસા છે. પછી સ્કંદગુપ્તે સુરાધ્રનો વહીવટ કરવા નીમેલા અધિકારી પર્ણદત્તનો પરિચય છે. પર્ણદત્ત આ નગરનો વહીવટ કરવા પોતાના પુત્ર ચક્રપાલિતને નીમ્યો હતો એવો ઉલ્લેખ એમાં છે. ઈ. સ. ૪૫૫-૫૬ માં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સુદર્શન તળાવ અતિવૃદ્ધિને લીધે તૂઠી ગચેલું અને ચક્રપાલિતના હુકમથી ઈ. સ. ૪૫૬-૫૭ માં તેનું સમારકામ થયું એ હકીકત તેમાં નોંધવામાં આવી છે.

આમ આ ખડક ઉપરના લેખોએ આ નગરના જીવનની કથા સાચવી છે. ગુજરાતમાં

મનુષ્યપ્રયત્નથી રચાયેલાં જળાશયો, તળાવો, વાવો, ઝૂવાઓ તેના સામાજિક જીવનના આધારરૂપ રહ્યાં છે એ હકીકિતનું સમર્થન આ લેખો કરે છે. ગુજરાતની સંસ્કૃતિ શાંકો સુધી સરોવરસંસ્કૃતિ રહી હતી. સુદર્શનથી શરૂ કરીને સહસ્રલિંગ સુધી એ પ્રણાલિકા સ્પષ્ટપણે દેખાય છે.

ઈ. સ. ૪૮૦ માં સ્કંદગુપ્તનો દેહાન્ત થયો. એ પછી પશ્ચિમ ભારતમાંથી ગુપ્તોની સત્તા તૂટવા લાગી. વલભીના મૈત્રકો ખળવાન બન્યા અને સ્વતંત્ર બન્યા.

મૌર્યો, ક્ષત્રપો અને ગુપ્તોના કાળમાં સાતસો વર્ષો સુધી ગિરિનગર ગુજરાત પ્રદેશનું પાટનગર રહ્યું હતું એ એ નગરના ધર્તિહાસની ખૂબ મહત્વની હકીકિત છે.

ઈ. સ. ૪૭૦-૭૫ ના અરસામાં ફૂણોએ ગુપ્ત સામ્રાજ્યને તોડી પાડ્યું. લગલગ એ જ કાળે વિજયસેન લદ્દારો વલભીના રાજ્યની સ્થાપના કરી. આ વલભીનું મહારાજ્ય લગલગ ત્રણ શતક સુધી ચાલ્યું. એ કાળમાં સૌરાષ્ટ્ર પ્રદેશ આપાદ બન્યો. આને એ પ્રદેશમાં જે ગામડાં છે તેમાંનાં ઘણું વલભી કાળમાં વસેલાં છે. એ સમયે સૌરાષ્ટ્ર પ્રદેશ

ખૂખ ‘આખાડ હતો. ચીની પ્રવાસી હુનુ-એન-સાંગ ઇ. સ.ના ૭ મા શતકમાં આઠથો હતો. તેણે એ કાળના સૌરાષ્ટ્રનું વર્ણન આપ્યું છે. આ કાળમાં ગિરિનગર વલભીના રાન્ધ્યકર્તાઓના શાસનમાં હતું. વલભીનો નાશ થયો ત્યારે ગિરિનગરનો સૂચો સ્વતંત્ર થઈ ગયો. અને તેણે ચૂડાસમા વંશનો આરંભ કર્યો એવી એક અટકળ કેટલાક ઇતિહાસ-કારોએ કરી છે; પણ વધુ સંભવ તો એવો છે કે ચૂડાસમાઓએ વલભીના સૂખાના વંશજ પાસેથી ગિરિનગર લઈ લીધું હોય.

ગિરિનગરમાંથી જૂનાગઢ નામ કેવી રીતે થયું હશે તેને અંગે અહીં વિચાર કરી લેવો ચોણ્ય છે. ચૂડાસમાઓના શાસનકાળમાં જ જૂનાગઢ નામ પ્રચલિત બન્યું છે એટલે ચૂડાસમાઓના ઇતિહાસની વાત કરીએ તે પહેલાં આ વિચારણા કરી લેવી ઉચિત છે.

એક વાત તો ચોક્કસ દેખાય છે કે પ્રાચીન ગિરિનગરના સ્થાને અથવા તેની નજીક આજનું જૂનાગઢ વસેલું છે. પ્રાચીન નગરોના અવશેષો ઉપર અથવા તેની નજીક નવાં નગરો વસે એવી પરંપરા તો ધણી જાણીતી છે. વધુ ઐદકામ થશે ત્યારે આપણુંને આને અંગે. વધુ પુરાવા મળશે.

ગિરિનગરને સ્થાને જૂનાગઢ વસ્તું હોય તો જૂનાગઢ નામ એવી રીતે વિકાસ પામ્યું તે પ્રશ્ન વિચારવા જેવો છે.

જીણુંહુર્ગ્યું એવો એક સંસ્કૃત શાષ્ટ્ર પ્રચલિત છે. પણ એ તો જૂનાગઢ નામ પડવા પછી તેનું સંસ્કૃત સ્વર્ણપ બન્યું હોય એમ લાગે છે. યવનહુર્ગ્યું એવી એક ખીલુ વ્યુત્પત્તિ આપવામાં આવે છે. એ કંઈક વધુ ચોણ્ય લાગે છે. અશોકના સમયમાં યવનરાજ તુખાસ્પતું અહીં શાસન હતું. ત્યારે એ સ્થાનને યવનહુર્ગ્યું એવું નામ મળ્યું હોય. યવનતું પ્રાકૃત રૂપાન્તર ચોન થાય અને તેના ઉપરથી જેન થાય. ચોનહુર્ગ્યું-જેનહુર્ગ્યું-જૂનાગઢ એ કેમે આ નામનો વિકાસ થયો હોય એવી જે અટકળ શ્રી રસિકલાલ પરીએ કરી છે, એ જરૂર વિચારવા જેવી છે.

ભાટોની એક દંતકથા છે. એ દંતકથા અનુસાર સિંધના સમા રાજ્યૂતવંશના ચૂડાચંદ્ર નામના રાજએ વામનસ્થલી-વંથલીમાં પોતાની ગાદી સ્થાપી હતી. આ ચૂડાચંદ્ર ચૂડાસમા વંશનો આદિ પુરુષ હોય એમ લાગે છે. ધંધુસરના લેખમાં તેને ચૂડાસમા વંશનો આદિ પુરુષ ગણ્યો છે. દંતકથા અનુસાર વલલીના નાશ પછી લગલગ સો વર્ષો

નવમા શતકના અંતે વામનસ્થલીમાં ચૂડાસમાઓનું રાજ્ય સ્થપાયું હતું.

ચૂડાસમા વંશના સ્થાપકના પૌત્રનો પૌત્ર રા'અહરિપુ ઈ. સ. ૮૪૦ થી ૮૮૨ સુધી જૂનાગઢની ગાઠી ઉપર હતો. એના સમયથી ચૂડાસમાઓ અને અણુહિલપુર પાટણુના સોલાકીઓ વચ્ચે વારંવાર વિશ્રદ્ધ થતા રહ્યા હતા. પણ એક અથવા બીજ સ્વરૂપે ચૂડાસમાઓનું રાજ્ય ટકી રહ્યું હતું. ગુજરાતની સ્વતંત્ર સહ્લતનત સ્થપાઈ એ પછી ઈ. સ. ૧૪૭૨ માં ચૂડાસમાઓના રાજ્યનો અંત આવ્યો. ચૂડાસમાઓના સમયમાં જ ઉપરકોટના નામથી એળખાતો કિલ્લો અસ્તિત્વમાં આવ્યો લાગે છે. એ કિલ્લો મૂળરાજના સમયથી દીવાન અમરાજના સમય સુધી લડાઈના પ્રસંગે જૂનાગઢના રાજ્યને ઘેરાના પ્રસંગે રક્ષણ આપતો રહ્યો છે. વારંવાર એનો જુણોદ્વાર થયો હશે એમ લાગે છે.

એક મજબૂત જોંચા ખડક ઉપર આ કિલ્લો ખાંધવામાં આવ્યો છે. મિરાતે અહમદી જણાવે છે કે, ઉપરકોટના કિલ્લાને ત્રણ દરવાજ છે પણ અત્યારે તો એને એ જ દરવાજ છે. ઉપરકોટમાં સૌથી છેદદી રચના પાણીની ટાંકીઓના ખાંધકામની થઈ હતી. ટાંકીઓ ખાંધવા માટે ખાંડકામ થયું ત્યારે

જૂના જમાનાની મજબૂત દીવાલો તેમજ કોડાઓના અવરોધો મળી આવ્યા હતા. એટલે ઉપરકોટના કિલ્લામાં અંદર એક નાનો કિલ્લો જૂના સમયમાં હશે એમ લાગે છે. કુવા જેવા દાણાના કોડાર પણ મળી આવ્યા છે. કિલ્લાને ઘેરો નાખવામાં આવે ત્યારે ઉપરોગમાં આવે એ હેતુથી અહીં અનાજનો સંઅહ થતો હશે. ખોદકામમાં અશોકની તેરમી આજા કેતરેલી એક શિલા મળી છે, કેટલીક પ્રાચીન મૂર્તિઓ મળી છે. જૂના જમાનાનાં ધાતુનાં વાસણો માણાં છે. એક ગુમલિપિમાં કેતરાયેલા પથરા મજયા છે. પુરાતત્ત્વવિહોએ આ બધાનો અભ્યાસ કરીને એવી અટકળ કરી છે કે મૌર્ય અને ગુમકાળમાં અહીં મંદિરો, ઘૌઢવિહારો વગેરે કદાચ હશે. ગુમ સમયના અંત પછી આ બધાનો નાશ થયો હશે અને એ જ સ્થળે ચૂડાસમાઓએ કિલ્લો બંધાવ્યો હશે.

ઉપરકોટમાં ત્રણ તોપો છે. કડાનાળ, નિલમ અને માણેક એવાં તેનાં નામ છે. એ બધી તોપો ઉપર અરથી લિપિમાં કેતરાયેલા લેખો છે. આ તોપો ગુજરાતના સુલતાન બહાઈરશાહના સમયની એટલે ઈ. સ. ૧૫૭૦ આસપાસની જણાય છે. લગલગ ૧૮ મી સફીના અંત સુધી આ તોપો ઉપરોગમાં આવતી હતી.

ઉપરકોટમાં અડીયડી વાવ અને નવધણું ફૂવો જોવા લાયક છે. એને અંગે કહેવત છે : ‘અડીયડી વાવ ને નવધણું ફૂવો, જે નવ જુઓ તે જીવતે ભૂઓ.’ નવધણું ફૂવામાં અંદર ઉત્તરવાનાં જે પગથિયાં છે તેની રચના વિશિષ્ટ છે. આ વાવ અને ફૂવો લગભગ અગિયારમી સહીનાં છે. એક જૂની મસ્તિજુદ ઉપરકોટમાં છે. એ કોઈ મંહિરને તોડીને બનાવવામાં આવી હોય તેવી છે.

ખાપરકોડિયાનાં જોંયરાંના નામથી એગા-  
આતી ગુરૂઓ વાસ્તવમાં બૌદ્ધ ગુરૂઓ જ છે.  
ઉપરકોટમાંની ગુરૂઓ પણ લગભગ એ જ  
સમયની છે.

ઉપરકોટ સિવાય જૂનાગઢમાં હિંદુ રાજ્યના  
સમયની નિશાનીઓ ખરું થોડી છે. વિશાળવાવ  
નામની એક વાવ કદાચ એ સમયની હશે. જૂના-  
ગઢ શહેરમાં જે મહેલો, મસ્તિજુદો, મકખરાઓ અને  
અગીયાઓ છે એ તો મુસ્લિમકાગના છે.

વાદેશ્વરી દરવાજેથી નીકળી ગિરનાર તરફ  
જતાં શિલાલેખવાળા ખડકથી આગળ પ્રસિદ્ધ  
દામોદર કુંડ આવે છે. સુવર્ણરેખા નહીને ખાંધીને  
આ કુંડની રચના કરવામાં આવી છે. કુંડના દક્ષિણ  
કાંઠે સમશાન છે. એ કુંડની ખંને બાજુ ઉપર પહાડ

છે. દક્ષિણે આવેલા કુંગરને રૈવતાચલ કહે છે અને ઉત્તરે આવેલા કુંગરને અસ્થિત્થામા કુંગર કહે છે. વહેમી લોકો માને છે કે અસ્થિત્થામા હળ્યે જીવે અને કુંગર ઉપર ફરતા દેખાય છે. આ કુંગરમાં પશ્ચિમે દામોદરજીનું મંદિર છે. આ આ મંદિરને ફરતો કોટ છે અને કુંડમાંથી મંદિર તરફ જવા માટે પગથિયાં છે. આ કોટ અને પગથિયાં દીવાન અમરજીએ બંધાવેલાં છે. આજે જે મંદિર છે તેની પશ્ચિમે રૈવતીકુંડ નામનો નાનો કુંડ છે, ત્યાં વિકિમ સંવત ૧૪૭૩નો લેખ છે. એટલે આ મંદિર ૧૫મા શતકથી વધુ જૂનું નથી. પણ એમાં જે મૂર્તિ છે તે સ્કંદગુપ્તના સમયમાં ઈ. સ. ના પ મા શતકમાં સુદર્શન તળાવના કિનારે બંધાયેલા વિષણુમંદિરમાંની પ્રાચીન મૂર્તિ હોવાનો સંલઘ છે. દીવાન અમરજીએ જ્યારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો ત્યારે કોટ બાંધવા માટે ઓદકામ કરતાં કેટલીક મૂર્તિએ મળી આવી હતી અને તેમાંથી એક મંદિરમાં પદ્મરાવવામાં આવી હતી. ઊંઠ એ મૂર્તિએ બળહેવ અને રૈવતીનાં મંદિરોમાં મૂકવામાં આવી છે. દામોદર મંદિરના એક થાંલલા ઉપર ગૃહસમયનું કોતરકામ છે. આ દામોદર કુંડ પાસે મહાપ્રલુણી ઘેઠક છે, તેમાં દીવાલમાં એક લેખ મળી આવ્યો છે. જ્યસિંહ ચૂડાસમાના સેના-

પતિ દામોદરે અહીં મઠ ખંધાવ્યો હતો એવો તેમાં ઉલ્કેખ છે. બીજાં કેટલાંક મંદિરો પણ અહીં છે. સિદ્ધેશ્વર, રાજરાજેશ્વર, ખ્રિશ્વર વગેરે તેનાં નામો છે.

દામોદરથી જરા આગળ ચાલીએ એટલે ગિરનાર હેખાય છે. રસ્તાની ડાખી ખાનુંએ દ્વારેશ્વર મહાદેવ છે. ત્યાં વહેતી નાની નહી પદાશિની કહેવાય છે. ત્યાંથી આગળ વસ્તાપથેશ્વર છે અને તેની સામે લવનાથનું મંદિર છે. મહાશિવરાત્રિના દિવસે લવનાથમાં ભોટો મેળો ભરાય છે. તેમાં આપા દેશમાંથી જુદા જુદા પંથના ખાવાએ આવે છે. લવનાથ પાસે મૃગિકુંડ છે. સ્કંદ પુરાણુમાં ગિરનાર માહાત્મ્યમાં આ લવનાથ અને મૃગિકુંડના માહાત્મ્યની કથા આલેખવામાં આવી છે.

પ્રાચીનતાની દૃષ્ટિએ તેમજ ઐતિહાસિક મહાત્વની દૃષ્ટિએ જૂનાગઢ ગુજરાતમાં સૌથી વધુ. મહાત્વનું નગર છે. શિલાલેખો એ આપણું સૌથી વધુ પ્રાચીન ઐતિહાસિક દસ્તાવેજ છે. મધ્યયુગે પણ જૂનાગઢનું મહાત્ર ધર્મં હતું. સુલતાન મહમદ બેગડાએ ઈ. સ. ૧૪૭૦માં રામાંડલિકનો પરાજય કર્યો ત્યારથી ખસો એંશી વર્ષ જેટલા સમય સુધી સૌરાષ્ટ્રનું કેન્દ્ર જૂનાગઢમાં જ હતું. સુલતાનોના

અને મોગલ શહેનશાહેના ફોજદાર ત્યાં રહેતા હતા. કુદરતે તેના રક્ષણુ માટે સગવડ આપી હતી અને મનુષ્યપ્રયત્ને તેને કિલ્લાઓ આપ્યા હતા. ઉપરકોટ અને ગિરનારના કિલ્લાઓ તો હતા જ પણ મહુમદ એગડાઓ શહેરની આસપાસ પણ કિલ્લો બંધાવ્યો હતો. અને શહેરને મુસ્તકાખાદ એવું નામ આપ્યું. પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ જૂનાગઢ સાથે સ્પર્ધા કરી શકે એવાં ભીજાં એ જ સ્થળ છે: ઈડર અને ચાંપાનેર. એ બંને પણ પર્વતહુર્ગો છે. જૂનાગઢ ઉપર મહુમદ એગડાઓ વિજય મેળાવ્યો હતો. ઈ. સ. ૧૪૬૭માં તેણું જૂનાગઢ જીતી લેવાનો વિચાર કર્યો હતો. એ વર્ષે તેણું ચઢાઈ કરી હતી અને રા'માંડલિકને હરાવ્યો હતો. પણ રા'માંડલિક સુલતાનના તાખેદાર તરીકે સત્તા લોગવતો રહ્યો હતો. એ છત્ર અને ભીજાં રાન્યચિડિના ધારણુ કરતો હતો. એટલે ભીજે વર્ષે સુલતાને ઝરીને ચઢાઈ કરી. રા'માંડલિકે છત્ર વગેરે ચઢાઈ કરનાર લશ્કરને સૌંપી દીધાં અને સુલતાનને નજરાણું મોકલ્યું. ઝરીને ઈ. સ. ૧૪૬૯ માં સુલતાને ચઢાઈ કરી, ત્યારે રા'માંડલિકે સુલતાનને મળીને પૂછ્યું: “મેં કશો ગુનો કર્યો નથી તો પણ તમે મારો નાશ કેમ કરવા માગો છો? ” ત્યારે મહુમદ એગડાએ જવાબ આપ્યો: “મૂર્તિં પૂજવા જેવો ભીજે કોઈ ગુનો નથી તેથો~~સર્વો~~

ઇસ્લામ સ્વીકારે।” રા’માંડલિક આ જવાખી ગલરાયો અને ગિરનારના કિલ્લામાં જઈને ભરાયો. એ વર્ષે સુધી ઘેરો ચાલુ રહ્યો અને જ્યારે ટકાય તેવું ન રહ્યું ત્યારે રા’માંડલિક સુલતાનને શરણે ગયો. તેને મુસલમાન બનાવવામાં આવ્યો. આમ જૂનાગઢના રાજ્યપુત રાન્યનો અંત આવ્યો.

ઈ. સ. ૧૫૭૪ માં અકબરે ગુજરાત ઉપર વિજય મેળાયો. એ પછી ૨૦ વર્ષે સુધી જૂનાગઢ અને નવાનગર ઉપર મોગલસત્તા આવી શકી ન હતી. સુલતાનેનો ઝોજુદાર તાતારખાન ઘારી લગભગ સ્વતંત્ર થઈ ગયો હતો. ૧૫૬૭ માં તે મૃત્યુ પામ્યો હતો. એના પછી તેનો પુત્ર અમીનખાન ઘારી જૂનાગઢમાં રાન્ય કરતો હતો. ગુજરાત ઉપર વિજય મેળવીને અકબર આથ્રા ગયો. તે પછી તેણે જૂનાગઢ કબજે કરવાની આજા કરી હતી. પણ એ માટેના પ્રયત્નમાં સફળતા મળી ન હતી. ૧૫૮૨ માં ફરીને પ્રયત્ન થયો. પણ એ નિષ્ઠળ ગયો. ગુજરાતનો છેલ્દો સુલતાન મુઅઈકેર ગ્રીને આ ખધા સમય દરમિયાન નવાનગરના જમની મહદ મેળવીને મોગલસત્તા સામે લડતો હતો. ઈ. સ. ૧૫૮૨ માં ભૂયર મોરીના ચુદ્ધમાં જ્યારે તેનો આખરી પરાન્ય થયો. ત્યારે જૂનાગઢ ઉપર મોગલસત્તા

સ્થાપી શકાય એવી પરિસ્થિતિ આવી. જૂનાગઢના કિલ્લાને ઘેરો ધાલવામાં આવ્યો અને ઈ. સ. ૧૫૬૨ ના ઓગસ્ટની ૨૭ મી તારીખે જૂનાગઢ મોગલસત્તા નીચે ગયું. એ પછી છેક ૧૭૪૮ સુધી મોગલસત્તા ચાલતી રહી. ઔરંગજેભના અવસાન પછી મોગલસત્તા નખળી પડતી હતી. ઈ. સ. ૧૭૪૮ માં શેરખાન ખાલી જૂનાગઢનો ઝોજુદ્દાર હતો. તેણે સ્વતંત્રતા જહેર કરી અને બહાદુરખાન નામ ધારણ કરી નવાખનો ઈંકાખ ધારણ કર્યો. ૧૭૪૮ થી ૧૮૪૮ સુધી એનું એ સહી સુધી જૂનાગઢમાં નવાખોનું રાજ્ય ચાલ્યું.

મોગલરાજ્યના સમયમાં જૂનાગઢનું જે મહત્વ હતું તેનો એક પુરાવો એ છે કે ત્યાં શાહેનશાહતની એક ટંકશાળની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાં સોનાના, ચાંદીના અને ત્રાંબાના સિક્કાઓ પાડવામાં આવતા. એ સિક્કાઓના નમૂના સચવાઈ રહ્યા છે.

આજે જૂનાગઢમાં જે લેવાલાયક મકાનો છે તેમાંનાં મહત્વનાં મકાનોનું ખાંધકામ સત્તરમી સહીમાં થયું છે. એ સમયનો સરદારખાગ તો આજ દિવસ સુધી સચવાઈ રહ્યો છે: નગરના વહન ઉપરના સુંદર તલની ઉપમા તેને દીવાન રણુછોડળું એ

‘તવારીએ સેચઠ’માં આપી છે.

ખાણી વંશના શાસન દરમિયાન અને સવિશેષ ઓગણીસમા શતકમાં તેમજ વીસમા શતકમાં જૂનાગઢમાં સુંદર મકાનોની રચના થઈ હતી. સફ્ફર ખાગમાં એક પ્રાણીધર પણ બનાવવામાં આવ્યું હતું. અને એ આજપર્યંત ત્યાં છે.

અદારમી સહીના છેલ્લા પાદમાં જૂનાગઢની મહત્ત્વા સૌરાષ્ટ્રમાં વધી હતી. એ વધારનાર દીવાન અમરળ મુત્સદી હતા અને કુશળ યુદ્ધવીર હતા. સૌરાષ્ટ્રમાં જૂનાગઢને એમણે ગાયકવાડનું સમોવડિયું સ્થાન અપાંગું હતું અને પરિણામે તો દેશી રાજ્યો રહ્યાં ત્યાં સુધી જૂનાગઢ પ્રથમ સ્થાને લેખાતું હતું.

જૂનાગઢના ઈતિહાસનું છેલ્લું મહત્વનું પ્રકરણ ઈ. સ. ૧૯૪૭-૪૮ માં લખાયું. એ પ્રકરણમાં મહત્વનો લાગ સરદાર વલલભાઈ પટેલે લજ્જયો. હતો. તે છેલ્લું પ્રકરણ ઈતિહાસની દિલ્લિએ કંઈક વિગતથી આલેખવા કેવું છે.

જૂનાગઢના એ વખતના નવાએ ચૌદમી આગસ્ટ ૧૯૪૭ સુધી લારતમાં જેડાવા માટેનો દેખાવ ચાલુ રાખ્યો. પણ પંદરમી આગસ્ટે એમણે જહેરાત કરી કે નું નાગઢ પાકિસ્તાન સાથે જેડાયું છે.

આ જહેરાત સાંલળીને દેશભરમાં સન-  
સનાઈ વ્યાપી ગઈ. સૌરાષ્ટ્રની પ્રણને તો એને  
પરિણામે ભારે આધાત થયો. જૂનાગઢ દરિયાકાંઠા  
ઉપર આવેલું અને સૌરાષ્ટ્ર સાથે આર્થિક, સામા-  
જિક અને માનવવંશવિષયક દિલ્લીએ અખંડ રીતે  
નેડાયેલું રાજ્ય હતું. તેની પ્રણમાં એંસી ટકાથી  
વધુ હિન્દુઓ હતા. એની હકૂમતમાં પ્રસિદ્ધ સેમ-  
નાથનું દેવાલય હતું અને ભીજાં સંખ્યાબંધ હિન્દુ  
અને જૈન તીર્થસ્થાનો હતાં. એનો મુલક ભારત  
સાથે નેડાયેલાં અનેક રાજ્યો સાથે કૂલગૂંથણીની  
જેમ નેડાયેલો હતો. એનું જે જૂનાગઢ પાકિસ્તાન  
સાથે નેડાય તો વેપાર અને વાહન્યવહીરની  
દિલ્લીએ અનેક ગૂંચો જિલ્લી થાય. જૂનાગઢને પાકિસ્તાન  
સાથે સીધી રીતે નેડનાર કોઈ લૌગોલિક તત્ત્વ ન  
હતું. દરિયામાર્ગે પાકિસ્તાન ત્યાંથી ત્રણુસો માદિલ  
ફર હતું.

વળી જૂનાગઢના નવાખની મહત્વાકાંક્ષાઓ  
માટી હતી. માંગરોળ, માણ્ણવહર, ખાંટવા, સરદારગઢ  
અને ખાખરિયાવાડનાં નાનાં રાજ્યો ઉપર એ  
સાર્વલોમત્વ માગતા હતા. પાકિસ્તાનના શાસકોની  
અવળી સલાહને તે અનુસરતા હતા. રાજ્યવહીવટમાં  
એ નવાખ રસ લેતા નહીં. એ વિચિત્ર મિનજવાળા

હતા. એમના જીવનમાં મુખ્ય રસ કૂતરાંએને પાળવાનો હતો. એ કૂતરાંએને એ રાજ્યંશીએની જેમ રાખતા હતા.

૧૯૪૭ના મે માં જૂનાગઢના દીવાન તરીકે સિંધના એક આગેવાન મુસ્લિમ લીગી નેતા શાહુનવાજ બુદ્ધો આંધ્રા હતા. એ ધતિહાસના પ્રવાહને પિછાનતા ન હતા. એમણે જ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડ્યું હતું. આને પરિણામે કટોકટીના પરિસ્થિતિ સર્જાઈ. ભારતે આ જોડાણુનો વિરોધ કર્યો, તો પણ પાકિસ્તાને એ જોડાણું મંજૂર રાખ્યું.

સરદાર સૌરાષ્ટ્રમાં પાકિસ્તાનનો પગદંડો જામે એ સહુન કરવા તૈયાર ન હતા. ૧૯૪૭ના સેપ્ટેમ્બરની સત્તરમી તારીખે જૂનાગઢની સરહદ ઉપર ભારતીય સેના ગોઠવી દેવામાં આવી. અદારમી તારીખે શ્રી વી. પી. મેનન જૂનાગઢ ગયા. એમનો હેતુ નવાખને વાસ્તવિકતાનું લાન કરાવવાનો હતો. એ નવાખને તો ન મળી શક્યા. દીવાનને મળ્યા. દીવાને એમને કહ્યું કે જે કંઈ વાત કરવી હોય તે પાકિસ્તાનની સરકાર સાથે જ કરવી જોઈએ. શ્રી મેનન માણ્ણાવદરના ખાનને પણ મળ્યા. એમણે પોતાના રાજ્યનું જોડાણું પાકિસ્તાન સાથે કર્યું હતું. એમણે શ્રી મેનનની વાત ન સાંલળી. માંગરોળના શોખસાહેબ જુદા

પ્રકારના માનવી હતા. એ શ્રી મેનન સાથેની વાતને અંતે તરત જ લારત સાથે જોડાયા.

આ સમય દરમ્યાન સૌરાષ્ટ્રના પ્રણાજનોના પ્રતિનિધિઓનું એક સંમેલન મુંખ્ય મુકામે મળ્યું. એ સંમેલને જૂનાગઢનો પ્રશ્ન પ્રણાયે હાથ ધરવો જોઈએ એમ ઠરાંયું. શ્રી શામળદાસ ગાંધીએ કાઠિયાવાડ પ્રણકીય મોારચો સ્થાપ્યો. એ મોારચાએ જૂનાગઢ ઉપર ચઢાઈ કરીને જૂનાગઢને નવાખના કબજ્જામાંથી છોડાવવાનું ઠરાંયું.

આના પ્રત્યાધાતર્યે જૂનાગઢના નવાએ માંગરોાગ અને બાખરિયાવાડમાં પોતાની ફેઝ મોકલી. માણુષવદરના ખાન પણ ત્યાંની પ્રણને રંજાડતા હતા; એટલે બાવીસમી આકટોબરે સૌરાષ્ટ્રની પોલીસે માણુષવદરનો કબજે લઈ લીધો હતો. નવેમ્બરની પહેલી તારીખે લારતીય સેનાએ બાખરિયાવાડ અને માંગરોાળનો કબજે સંભાળી લીધો હતો.

શ્રી શામળદાસ ગાંધીના આંહોલનમાંથી પ્રેરણું મેળવીને જૂનાગઢની પ્રણાયે ખળવો પોકાર્યોહતો. એ પરિસ્થિતિમાં નવાખ બચાવ કરી શકે એવું હતું નહીં. પાકિસ્તાન એમને કોઈ મદદ પહેંચાડી શક્યું નહીં. ભયલીત બનીને નવાખ પરીસમી આકટોબરે

વિમાનમાર્ગે નાસી ગયા. એ પોતાની સાથે પોતાનું કુદુંખ, પોતાનાં માનીતાં ફૂતરાંએ અને રાજ્યની તિનેરીમાંથી લગભગ એક કરેાડ ઇપિયાની સરકારી અનામતો લઈ ગયા હતા.

એ દિવસ પછી તો દીવાને કાયદે આજમ જીણુને લખી નાખ્યું કે, રાજ્યમાંના મુસલમાનો પાકિસ્તાનને સાથ આપવા તૈયાર નથી. મુસલમાન આગેવાનોએ દીવાનને સલાહ આપી કે એમણે અથડામણું કરવી નહીં. સાતમી નવેમ્બરે દીવાનને રૂપેષ દેખાઈ ગયું કે પોતાના માટે રાજ્યવહીવટ ચલાવવાનું શક્ય નથી. એમણે ભારત સરકારને રાજ્યનો વહીવટ સંભાળી લેવા વિનંતી કરી. ભારત સરકાર વહીવટ સંભાળે તે પહેલાં તો દીવાન પાકિસ્તાન તરફ રવાના થઈ ગયા હતા. નવેમ્બરમાં રાજકોટના પ્રાદેશિક કમિશનરે જૂનાગઢનો કષેળે સંભાળી લીધો. આ પછી થોડા જ સમયમાં લોકમત લેવામાં આવ્યો હતો. તેમાં એક લાખ નેવું હજર આડસો સિસ્ટર મત ભારતને પણે પડચા હતા અને માત્ર એકાણું મત પાકિસ્તાનને પણે પડચા હતા. આ પછી જૂનાગઢ રાજ્યને એક વહીવટદાર નીચે મૂકવામાં આવ્યું હતું. એ વહીવટદારને સલાહ આપવા શ્રી શામળદાસ ગાંધી સહિત ત્રણ સભ્યોની

એક સમિતિ રચવામાં આવી હતી. જૂનાગઢ રાજ્યની એક લોકપ્રતિનિધિસભા એ પછી ચૂંટાઈ હતી. એ સભાએ ૧૯૪૮ના ફેબ્રુઆરીની વીસમી તારીખે સર્વાનુમતે જૂનાગઢ સૌરાષ્ટ્ર સાથે વિલીન થઈ જાય એવો નિર્ણય કર્યો હતો.

જૂનાગઢની આ ધતિહાસકથામાં આપણે એક ખૂબ પ્રચલિત વાતનો ઉલ્લેખ કર્યો નથી. એ સકારણું કર્યો નથી. રા'ખેંગાર, રાણુકહેવી અને સિદ્ધરાજનાં પાત્રો આસપાસ વણુચેલી દંતકથાની એ વાત છે. દંતકથા તો કહે છે કે સિદ્ધરાજે રા'ખેંગાર અને તેના એ પુત્રોનો વધ કર્યો હતો. અને પછી તે રાણુકહેવીને ઉપાડીને પાટણું જતો હતો. ત્યાં માર્ગમાં વઠવાણું પાસે રાણુકહેવી સતી થઈ. આ દંતકથા છે. તેને ધતિહાસનું સમર્થન મળતું નથી. સાચી વાત એમ લાગે છે કે સિદ્ધરાજે જૂનાગઢના રા'નો પરાજ્ય કર્યો હતો. અને તેને કેદ પડીને એ પાટણું લઈ ગયો હતો; તેની પાસે માર્ગમંગાવીને તેને મુક્તા કર્યો હતો. સંલવ એવો છે કે તેની રાણી તેની પાછળ પાટણું આવી હુશે. પાટણુથી પાછા ફરતાં વઠવાણું નજીક રા'નું મૃત્યુ થયું હુશે અને રાણી સતી થઈ હુશે. રાણુકહેવી સામાન્ય નામ છે કે વિશેષ નામ છે તેને વિષે પણ સંદેહ છે.

માત્ર ગુજરાતના જ ઈતિહાસમાં નહીં,  
કુનિયાભરના ઈતિહાસમાં જૂનાગઢનું સ્થાન એક રીતે  
વિશિષ્ટ છે. અઢી હજાર વર્ષ સુધી જે નગરનો  
ઈતિહાસ સળંગ મળતો હોય એવાં નગરો બહુ થોડાં  
છે. તેમાં પણ આટલો વિગતપૂર્ણ અને સ્પેષ્ટ ઈતિહાસ  
તો કદાચ ખીજાં કોઈ નગરનો મળતો નથી. ખૌદ્ધ,  
કૈન અને વૈદિક પરંપરાઓનું કેન્દ્ર આ નગરમાં  
રહ્યું છે. એક મહત્વનું શાક્તપીઠ અહીં રહ્યું છે  
અને શૈવ સંપ્રદાયનું કેન્દ્ર પણ ત્યાં રહ્યું છે. અભિત  
સંપ્રદાયમાં જેમને ખૂણ મહત્વ અપાયું છે તે  
નરસિંહ મહેતા અહીં થઈ ગયા છે. પીર જમિયલ  
શાહ દાતાર જેવા ઈસ્લામી ઓલિયાનું અહીં  
પ્રવૃત્તિકેન્દ્ર રહ્યું છે. ડૉ. લગવાનલાલ ઈન્દ્રજિ,  
શ્યામજી કૃષ્ણ વર્મા અને એવા ખીજા અર્વાચીન ચુગના  
અગ્રેસરોએ અહીં પ્રવૃત્તિ કરી છે. નર્મદના સમોવ-  
ડિયા મણિશાંકર કીકાણી જેવા સમાજસુધારકોએ આ  
નગરમાં વસીને અર્વાચીન ચુગના પ્રારંભમાં મહત્વનું  
પ્રદાન કર્યું છે. નવા ગુજરાતનું ઘડતર કરનારા  
સંખ્યાખંડ સ્નાતકો જૂનાગઢની ખણાઉદીન કોલેજે  
આપ્યા છે. સ્વાતંત્ર્યસંઘામના અનેક અગ્રેસરો  
જૂનાગઢ આપ્યા છે. પ્રાચીનકાળો, મધ્યયુગો અને  
અર્વાચીન ચુગે જૂનાગઢનો ઈતિહાસ જેમ ધરાસ્વી

છે તેમ તેનું લાવિ પણ એવું જ ઉજ્જવત હોયે  
એમ કહીએ. એવી રતનગાલ્બા વસુંધરા આ ગિરિનગર  
જૂનાગઢની છે.



ગુજરાત પરિચ્ય માળામાં  
પ્રગાટ થયેલાં પુસ્તકો



અમહાવાદ

દ્વારકા

વડોદરા

ભુજ

સોમનાથ

ભરૂચ

પાટણ

# ગુજરાત પરિચય

લેખક : ધનવંત

આપણા ગુજરાત પ્રદેશનું સાંસ્કૃતિક, રાજકીય દૃષ્ટાદિ દખ્ટિએ સાચા વિધાર્થીઓને-રસ પડે એ દખ્ટિએ પરિચય આપવાના હેતુથી આ શ્રેષ્ઠી શાહ થાય છે.

આ ભાગામાં લગભગ ૧૦૦ પુસ્તિકા પ્રસિદ્ધ કરવાની ધારણા છે. તેના પ્રથમ ગુરુભાઈં ૨૪ પુસ્તિકા પ્રસિદ્ધ થશે. પ્રથમ ગુરુભાઈનું લવાજમ રૂ. ૧૫-૦૦ રહેશે. ટપાલખર્ચ સંચાલક બોગવશે.



**પ્રસિદ્ધ અયેલી પુસ્તિકાઓ :** ૧. અમદાવાદ, ૨. દારકા, ૩. વડોદરા, ૪. ભૂજ, ૫. સોઅનાથ, ૬. અદ્ય, ૭. પાટણ, ૮. જૂનાગઢ.

**હવે પણી :** ૯. અંલાત, ૧૦. વલબી, ૧૧. પોરબંદર, ૧૨. વડનગર, ૧૩. સુરત, ૧૪. નાનાદ, ૧૫. શિહેર, ૧૬. શ્રીમાળ-લિનમાળ, ૧૭. ગિરનાર, ૧૮. સાબરમતી, ૧૯. આણ, ૨૦. નર્મદા, ૨૧. શાનુંઝ્ય, ૨૨. મહીસાગર, ૨૩. પાવાગઢ, ૨૪. તાખી.




---

## પ્રકાશક



**નવચેતન પ્રકાશન ગૃહ**

૩, પંક્ષે સોસાયટી, સરઘેજ રોડ, અમદાવાદ-૭

**કિંમત : ૧-૦૦**

